



RIDDHI CORPORATE SERVICES LIMITED

ISO 9001:2015, 27001:2013 & CMMI Level 3 Certified Company

CIN: L74140GJ2010PLC62548

Date: May 6, 2019

To,
BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai – 400 001.

Dear Sir,

Sub: Submission of Copy of Newspaper Advertisements for Postal Ballot and E-voting

Ref: Riddhi Corporate Services Limited

(Security Code: 540590 Security Id: RIDDHICORP)

With reference to captioned subject, we hereby submit the News Paper Advertisements published today confirming the Dispatch of Notice of Postal Ballot and details of voting.

Kindly take the same on your record and oblige us.

For, Riddhi Corporate Services Limited

M. V. Joshi

MANISH V. JOSHI
CHIEF FINANCIAL OFFICER



Encl: A/a.

Business Brief

US stocks rally amid robust jobs data

New York, US stocks rallied on Friday as market sentiment was fuelled by the better-than-expected jobs data. The Dow Jones Industrial Average jumped 197.16 points, or 0.75 per cent, to 26,504.95. The S&P 500 rose 28.11 points, or 0.96 per cent, to 2,945.63. Xinhua news agency reported the Nasdaq Composite Index climbed 122.22 points, or 1.58 per cent, to 8,164.00. All the 11 primary S&P 500 sectors traded on an upbeat note throughout the session and finished higher. Consumer discretionary and industrials gained 1.40 per cent and 1.24 per cent, respectively, outpacing the rest.

Major US tech-heavy stocks or the so-called FAANG group of Facebook, Apple, Amazon, Netflix and Google-parent Alphabet, advanced, contributing to the market rally. Wall Street cheered the robust US jobs data. US total nonfarm payroll employment increased by 263,000 in April, according to the Department of Labor on Friday. The reading easily topped market consensus. Notable job gains occurred in professional and business services, construction, health care, and social assistance.

US dollar falls amid weaker manufacturing data

New York, The US dollar decreased in late trading on Friday, as investors digested a batch of US economic data, amid worries over slowing activities in the manufacturing sector.

In late New York trading, the euro increased to \$1.1194 from \$1.1175 in the previous session, and the British pound rose to \$1.3164 from \$1.3207 in the previous session, Xinhua news agency reported.

The Australian dollar was up to \$0.7014 from \$0.6997.

The US dollar bought 111.09 Japanese yen, lower than 111.49 Japanese yen of the previous session. The US dollar bought 1.0174 Swiss franc from 1.0193 Swiss franc, and it decreased to 1.3427 Canadian dollars from 1.3470 Canadian dollars.

The Institute for Supply Management's non-manufacturing index declined to 55.5 per cent in April, 0.6 percentage point down from 56.1 per cent in March, which marks the slowest reading since August 2017, said the not-for-profit professional supply management organization on Friday.

Imagica Summer Escapades – Time To Recoup With Your Group

Mumbai, As summer has come knocking, kids and adults alike, are all looking at avenues to rejuvenate together in a fun and exciting way. Imagica, India's largest themed destination with all its world-class attractions and experiences is geared up to make the summer truly awe-some. With temperatures touching 40s in the sweltering summer, air conditioned homes and movie theatres are not the only respite for your gang of friends or families.

CHANGE OF NAME	CHANGE OF SURNAME
I have changed my old name from ANJANABEN SHANTILAL PATEL to New Name ANJANA DIPEN PATEL. Add: - 36, Amitsar Society, Ghodasara, Ahmedabad-380015. 222A	I have changed my old surname from MONA HITESHKUMAR BOHRA to New Name MONA HITESHKUMAR JAIN. Add: - 903, Safal Flora, ShahiBagh Ahmedabad 380015. 222

Now's an excellent learning opportunity for Indian credit markets

By Taponeel Mukherjee

News on Indian credit markets over the last few weeks provide us with pointers that should help shape policy and business strategy. The struggle to get bidders for Jet Airways and the tepid response from investors towards India's fledgling municipal bond market point towards the need for a better-structured credit market, especially as the nature of businesses evolve even as the demand for credit rises to finance consumption and infrastructure needs.

The lack of investor interest in Jet Airways, driven in no small extent by a lack of clarity around how the carrier will resolve its debt issues points towards the need for better assessment of risk scenarios by lenders moving forward. Assessing risk scenarios are essential as businesses such as Jet Airways that have relatively fewer tangible assets utilise the debt markets. From a lender's perspective, not finding a prospective buyer for Jet Airways implies potentially sending it to the bankruptcy court. But for

businesses that do not have a significant quantity of fixed assets, the value realisation from bankruptcy courts can be meagre.

The fact that Jet Airways has lower value realisation in the case of bankruptcy begs the question as to what changes do lenders need to implement in their credit models to deal with such companies going forward. As the economy evolves, businesses that borrow will have balance sheets that perhaps hold more intangible assets. In the case of Jet Airways, unlike say a steel business, a majority of its fixed assets, i.e. planes are leased, and therefore bankruptcy proceedings can realise limited value. The pertinent point is that lenders must do a better job in pricing these risks moving forward as lenders to companies with more and more intangible assets picks up. In other relevant news, the lukewarm investor interest in the municipal bond market in India is one that merits attention. Given the scale of urban infrastructure required, municipal bonds could be a critical financial instrument to plug

the financing gap. However, given the current challenges and the stage of evolution of the bond market, a vibrant and functional municipal bond market will require significant ground-work.

Clarity around municipal funding, or more specifically, the payment mechanism of the municipal bond, would be vital to attracting investor interest. Answering the fundamental questions of "who pays" and "are they willing to pay consistently" are the priority of the concerns people have with municipal bonds. Ensuring an adequate payment mechanism will require a lot of work to help cities plan and budget financing efficiently.

Depth of the benchmark government bond curve will also be vital to creating appetite for municipal bonds since investors will utilise the government bond curve as a benchmark. The eventual aim is to create a market and an ecosystem for municipal bonds that encapsulates market makers, price transparency, risk-benchmarks and

mechanisms for redressal of problems.

The issues around both Jet Airways bankruptcy and the municipal bond market point towards critical areas that credit markets in India need to hedge their risks in. Given the dynamic nature of business, lending standards and procedures that worked for companies in the more traditional industries may not be well suited for new age businesses.

The question isn't merely about how much to lend, but also is one about security design whereby the question arises as to whether collateralised debt instruments allowed lenders to truly hedge their risks in a world where asset-liability models abound?

As credit markets get more sophisticated, more attention will have to be paid to security design above and beyond what standard debt instruments have to offer. Security design implies bespoke instruments designed to reflect both the cash flow risk of businesses and the ability for recovery in the case of default.

Gujarat Water Supply and Sewerage Board, Gandhinagar

TENDER NOTICE No. 1/2019-20

Executive Engineer, P.H. Mechanical Dn, GWSSB, Hajimarket, 1st Floor, Opp. Jilla Sevashan-2, Tithal Road, Valsad-396001. Phone No.: 99784 41274 invites on-line tenders for Drilling 165mm dia X Up to 90.00 mtr. Deep bore by DTH Rig for Different Water Supply Scheme of Different Villages of (1) Chikhli Taluka, Dist. Navsari, (2) Khergam Taluka, Dist. Navsari (3) Vansda Taluka, Dist. Navsari from those who are registered in appropriate class and having work experience for tender ID No. 358856, 358857, 358858 with cost of (1) Rs: 14.40 Lakhs, (2) Rs: 12.96 Lakhs, (3) Rs: 45.00 Lakhs respectively. The interested contractors shall have to pay required tender fee/EMD in prescribed manner. Further details can be made available on web site www.nprocure.com & www.gwssb.nprocure.com & www.statetenders.com. Further any amendment made will be disburse only on above web site only. The last date of tender downloading/uploading is Dtd: 13.05.2019 up to 18.00 hrs.

Gujarat Water Supply and Sewerage Board, Gandhinagar

TENDER NOTICE No. 4/2019-20

Executive Engineer, P.H. Mechanical Dn, GWSSB, Hajimarket, 1st Floor, Opp. Jilla Sevashan-2, Tithal Road, Valsad-396001. Phone No.: 99784 41274 invites on-line tenders for Drilling 165mm dia X Up to 90.00 mtr. Deep bore by DTH Rig and Installation of India Mark-II Hand Pump and construction of C.C. Platform as per UNICEF design & Drawing with soak pit for the year 2019-20 of different villages of Chikhli, Khergam & Vansda Taluka Dist. Navsari from those who are registered in appropriate class and having work experience of tender ID No. 358855 with cost of Rs: 18.39 Lakh, respectively. The interested contractors shall have to pay required tender fee/EMD in prescribed manner. Further details can be made available on web site www.nprocure.com & www.gwssb.nprocure.com & www.statetenders.com. Further any amendment made will be disburse only on above web site only. The last date of tender downloading/uploading is Dtd: 13.05.2019 up to 18.00 hrs.

TOLL FREE NO. 1916

For rural level water supply scheme, 24 hours control room activate at state level, where, for complain / suggestion toll free No. 1916 can be contacted. Water supply & Sewerage Gujarat Government

No.INF/Valsad/40/2019

TOLL FREE NO. 1916

For rural level water supply scheme, 24 hours control room activate at state level, where, for complain / suggestion toll free No. 1916 can be contacted. Water supply & Sewerage Gujarat Government

No.INF/Valsad/41/2019

JAYATMA ENTERPRISES LIMITED

FORMERLY KNOWN AS JAYATMA SPINNERS LIMITED

Regd Office:- 259, 3rd Floor, New Cloth Market, O's Raipur Gate, Ahmedabad- 380 002, Gujarat (India)
Website: www.jayatmaenterprises.com | Mail us on: info@jayatmaenterprises.com
Ph. No.: 079- 22167030/40 CIN: L17110G1983PLC006642

EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER/TWELVE MONTHS ENDED ON 31.03.2019

(Rs. in Lacs except per share data)

Sl. No.	Particulars	Quarter Ended		Year Ended	
		31.03.2019	31.03.2018	31.03.2019	31.03.2018
1	Total income from operations (net)	11.90	11.90	11.9	47.85
2	Net Profit / (Loss) from ordinary activities before tax, exceptional and extraordinary items	9.63	3.77	9.91	29.51
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	9.63	3.77	9.91	29.51
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	11.18	3.82	8.66	27.31
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period(after tax)and Other Comprehensive Income(after tax)]	11.18	3.82	8.66	27.31
6	Equity Share Capital	300.00	300.00	300.00	300.00
7	Reserves (excluding Revaluation) as shown in the Balance Sheet of previous year				225.17
8	Earning Per Share (of Rs. 10/- each) (for continuing operation)				
	Basic:	0.37	0.13	0.29	0.91
	Diluted:	0.37	0.13	0.29	0.91
9	Earning Per Share (of Rs. 10/- each) (for discontinuing operation)				
	Basic:	0.37	0.13	0.29	0.91
	Diluted:	0.37	0.13	0.29	0.91

Note: The above is an extract of the detailed format of quarterly / Annual Financial Result filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly / Annual Financial Result are available on the Company's website i.e. www.jayatmaenterprises.com and Stock Exchange website i.e. www.bseindia.com.

Date: 04.05.2019
Place: Ahmedabad

For, JAYATMA ENTERPRISES LIMITED
Sd/- Nirav K. Shah (DIN : 00397336)
Chairman & Managing Director

JAYATMA INDUSTRIES LIMITED

Formerly Known as Santarum Spinniers Limited

Regd Office:- 259, 3rd Floor, New Cloth Market, O's Raipur Gate, Ahmedabad-380002 Gujarat (India)
Website: www.jayatmaindustries.com | Mail us on: info@jayatmaindustries.com
Ph. No.: 079- 22167030/40 CIN: L17110G1983PLC006642

EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER/TWELVE MONTHS ENDED ON 31.03.2019

(Rs. in Lacs except per share data)

Sl. No.	Particulars	Quarter Ended		Year Ended	
		31.03.2019 (Audited)	31.03.2018 (Unaudited)	31.03.2019 (Audited)	31.03.2018 (Audited)
1	Total income from operations (net)	4161.45	4173.13	3592.68	15100.60
2	Net Profit / (Loss) from ordinary activities before tax, exceptional and/or extraordinary items	3.91	23.61	32.46	61.59
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	3.91	23.61	32.46	61.59
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	10.67	17.01	16.06	50.55
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period(after tax)and Other Comprehensive Income(after tax)]	10.67	17.01	16.06	50.55
6	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of Previous year)	615.30	615.30	615.30	615.30
7	Earning Per Share (of Rs. 10/- each) (for continuing operation)				
	Basic:	0.17	0.28	0.26	0.82
	Diluted:	0.17	0.28	0.26	0.82
9	Earning Per Share (of Rs. 10/- each) (for discontinuing operation)				
	Basic:	0.17	0.28	0.26	0.82
	Diluted:	0.17	0.28	0.26	0.82

Note: The above is an extract of the detailed format of quarterly / Annual Financial Result filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly / Annual Financial Result are available on the Company's website i.e. www.jayatmaindustries.com and Stock Exchange website i.e. www.bseindia.com.

Date: 04.05.2019
Place: Ahmedabad

For, Jayatma Industries Limited
Sd/- Nirav K. Shah (DIN : 00397336)
CEO & Director

REVIVE PETPLAST LLP

5, NILKANTH ESTATE PHASE-2, VILLAGE HVAVA (VASNA), T.SANAN, AHMEDABAD-380015. UFN: AAJ9294

Form No. URJ-2

Advertisement giving notice about Revive Petplast LLP as per Part of Chapter XXII of the Act (Pursuant to section 37(2) of the Companies Act, 2013 and rule 4(1) of the Companies (Amendment) Regulations, 2013.

1. Notice is hereby given in pursuance of sub-section (2) of section 366 of the Companies Act, 2013, an application is proposed to be made after fifteen days hereof but before the expiry of thirty days hereinafter to the Registrar at Central Registrar Center (CRC), Maharashtra that REVIVE PETPLAST LLP, a LLP may be registered under Part of Chapter XXII of the Companies Act, 2013, as a Company Limited by shares.

2. Principal objects of the company are as follows:
To Carry on Business Activity of Manufacturing and Trading of All kinds of Plastic and Polyethylene Products.

3. Copy of the draft Memorandum and articles of association of the proposed Company may be inspected at the office at 5, NILKANTH ESTATE PHASE-2, VILLAGE HVAVA (VASNA), T.SANAN, AHMEDABAD-380015, Gujarat, India.

4. Notice is hereby given if any person objecting to the application may communicate their objection in writing to the Registrar at the Registrar Center (CRC) India Institute of Corporate Affairs (ICA) Flat No. 6, 7, 8, Sector-4, IIT-Mansarovar, Dist. Gurgaon Haryana - 122050 within the date of publication of this notice, with a copy to the Company at its registered office.

Date - 02.05.2019
Name(s) of Applicant - 1. Kashishan A. Sharma
2. Arvindbhai J. Sharma

Western Railway to run 18 Services of Weekly AC Special Train between AHMEDABAD & HABIBGANJ

AHMEDABAD ↔ HABIBGANJ 18 Trips

(From 06-05-2019 to 02-07-2019)

Train No.	Departure	Arrival	Dates of Service
01669	Ahmedabad 10.40 hrs (Every Tuesday)	Habibganj 23.45 hrs (Same day)	07.05.2019 to 02.07.2019
01670	Habibganj 20.45 hrs (Every Monday)	Ahmedabad 09.00 hrs (Next day)	06.05.2019 to 01.07.2019

Halts: Nadiad Jn., Dakor, Godhra, Dahod, Meghnagar, Raitlam, Nagda Jn., Ujjain, Maksi, Sujapur, Sehore and Sant Hirdaram Nagar in both directions.

Composition: AC-3 Tr Coaches.

Booking for Train No. 01669 will open from 5th May, 2019 at all Passenger Reservation Centres and IRCTC website

Special Train on Special Fare

Western Railway

www.indianrailways.gov.in

Like us on Facebook.com/WesternRly | Follow us on Twitter.com/WesternRly

PL. CARRY ID PROOF FOR ALL RESERVED TKTS.

RIDDI CORPORATE SERVICES LIMITED

CIN: L74140GJ2010PLC026258

Registered Office: 259, 3rd Floor, New Cloth Market, O's Raipur Gate, Ahmedabad - 380 003 Telephone: +91-79- 26590767; Website: www.riddicorporateservices.com; Email: Investor@rcspl.net

NOTICE OF POSTAL BALLOT

NOTICE is hereby given in pursuance of section 109 and 110 of the Companies Act, 2013, as amended (the "Act") read with Rule 20 and Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014 (the "Rules") (including any statutory modification or re-enactment thereof for the time being in force) and all other applicable provisions of the Companies Act, 2013 and rules made there under, Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and other applicable laws and regulations, that the approval of members of Riddi Corporate Services Limited ("The Company") is being sought for the above mentioned business/financial matters, have been proposed in the notice of Postal Ballot dated April 29, 2019, by way of Physical Postal Ballot and voting by electronic means (hereinafter termed as "Remote Voting").

1. Migration of Company's present listing from SME Platform of BSE Limited to the Main Board of BSE Limited.

The Company has completed the dispatch of Postal Ballot Notice along with Postal Ballot Form on May 03, 2019 to all the shareholders of the Company whose names appear in the Register of Members as maintained by the Registrar and Share Transfer Agent of the Company and beneficial owners as received from the Depositories on Friday, April 26, 2019 ("Cut Off Date") through physical mode along with a self addressed, prepaid postage envelope to the shareholders.

The Company has engaged the services of Central Depository Services (India) Limited (CDSL) for the purpose of providing remote voting facility to all its Members. Members may note that the voting period commences from 08:00 hours IST on Monday, May 06, 2019 and will end at 17:00 hours IST on Tuesday, June 04, 2019. The e-voting mode will be disabled for voting thereafter by CDSL and remote voting shall not be allowed beyond the said date and time. The Members can opt for only one mode of voting, i.e., voting mode by physical ballot or e-voting. In case Members cast their votes through both the modes, voting done by e-voting shall prevail and votes cast through physical Postal Ballot Form will be treated as invalid. The detailed procedure for voting has been mentioned in the Postal Ballot Notice and Form.

The Board of Directors of the Company has appointed M/s. Amish Ganesh & Associates, Practicing Company Secretary (Members' Secretariat) (FICSI & ICAI No. 5656) as the Scrutinizer for conducting the postal ballot and to scrutinize the votes received through postal ballot and remote e-voting in a fair and transparent manner. The Members are requested to note that the duly completed postal ballot form(s) should reach the Scrutinizer not later than 17:00 hours IST on Tuesday, June 4, 2019 to be eligible for being considered for voting. Postal ballot received from the member beyond the said date and time will not be valid and whether by post or by electronic means shall not be allowed beyond the said date and it will be strictly considered to be null and void.

The result of postal ballot shall be declared on or before Wednesday, June 5, 2019 at the registered office of the Company and communicated to the stock exchange, e-voting agency and shall also be displayed on the Company's website at www.riddicorporateservices.com.

Member who does not received the Postal Ballot Notice and Form may send an email to Investor@rcspl.net or may apply to the Registrar and Transfer Agent of the Company and obtain a duplicate Postal Ballot Notice and Form. The Registrar and Transfer Agent/ Company shall forward the same along with postage prepaid self-addressed Business Reply Envelope to the member. The Postal Ballot Notice and Form can also be downloaded from the website of the Company at www.riddicorporateservices.com and website of e-voting agency www.evotingindia.com in case of any queries, you may refer to the website of the Company or contact the shareholders and e-voting user manual for shareholders available at the "downloads" section of www.evotingindia.com or call toll free no: 1800-22-52523. In case queries / grievances related to the Postal Ballot Notice and Form, the Registrar and Transfer Agent/ Company Secretary and Compliance Officer, Riddi Corporate Services Limited, 10, Mill Officers Colony, Behind Old RBI, Ashram Road, Ahmedabad - 380 009, India or call on telephone: +91-79- 2659 0767; Email: Investor@rcspl.net

For, Riddi Corporate Services Limited
Sd/- Apil Agr
Date: 3rd May, 2019
Whole-Time Director (DIN - 03041615)

पंजाब नैशनल बैंक Punjab National Bank

भरोसे को प्रतीक the name you can BANK upon !

(A GOVERNMENT OF INDIA UNDERTAKING)

E-AUCTION SALE NOTICE TO GENERAL PUBLIC

Whereas under Section 13(2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002, the Authorized Officers have issued Demand Notice for recovery of sums from the borrowers/guarantors/mortgagors (herein referred to as borrowers) as per details given below against each borrower. Further, in exercise of powers contained in the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002, the respective Authorized Officers have taken possession of the under mentioned secured assets which are held as securities in respect of the Credit Facilities granted to the borrowers listed below. Whereas sale of the secured assets is to be made through Public E-Auction for recovery of the secured debts due to Punjab National Bank from the borrowers as per demand notice plus future interest, costs and charges incurred by the Bank thereon, less recoveries if any, thereafter.

The General Public is invited to bid either through personally or by duly authorized agent. Bank will be free to bid for eligible properties.

SCHEDULE OF SALE OF THE SECURED ASSETS

S. No.	Name of Borrower & Bank Branch	Date of Demand Notice and Outstanding Amount Mentioned Therein	Description of Property along with name of Mortgagor (Owner of the Property)	Status of Possession (Physical / Symbolic)	Reserve Price	Earnest Money Deposit (EMD) Amount	Last Date of EMD to be Deposited	Details of Account in Which EMD is to be Deposited	Date and Time of Inspection of Property	Date and Time of Auction	Incremental Bid Amount	Name and Contact No. of Authorized Officer/Nodal Officer	Outstanding Amt. If Any
1	M/s United Foods Pvt. Ltd. BC, ARMB NEW DELHI	11.01.2012 Rs. 102.61 Lacs	LEASEHOLD Factory land & Building Industrial Plots with Warehouse at GSDIC, DHRUB Murda (Nos. 41/6943 sq mtr), 42/3855 sq mtr & 43/3050 sq mtr), Dhrub Rev Survey No 168 Park, Dhrub GIDC, Adani Port Road, Taluka: Mundhra, Kutch, Gujarat. In the name of M/s United Foods Pvt.Ltd.	PHYSICAL	Rs. 100.00 Lacs	Rs. 100.00 Lacs	20.05.2019	PUNJAB NATIONAL BANK, ARMB DRT Account No 152202000019 (IFSC CODE PUNB0152200)	16.05.2019 11:00 AM	22.05.2019 04:00 PM	Rs. 100000/-	Authorized Officer: Sh. Anoop Kumar Saxena Chief Manager, 802622333 Nodal Officer: Sanjeev Aroia CRM Mb: 9873055550	Not Known

BRIEF TERMS AND CONDITIONS OF E-AUCTION SALE: The sale shall be subject to the Terms & Conditions prescribed in the Security Interest (Enforcement) Rules 2002. 1. The properties are being sold on As is Where is Basis. 2. The auction sale will be "online through e-auction" portal http://pnbidia.biz. 3. The interested bidders are required to obtain login ID and Password in advance through SMS/mail by contacting the Nodal Officers mentioned above against each property which is mandatory for e-bidding. 4. The authorized officer reserves the right to accept any or reject all bids if not found acceptable or to postpone/cancel the auction at any time without assigning any reason whatsoever and his decision in this regard shall be final. 5. In case bid is placed in last 5 minutes of the closing time of the auction, the closing time will automatically get extended by 5 minutes. 6. The Bidder shall upload scanned copies of PAN Card & proof of Residential address. The Bidder other than individual shall also upload proforma for e-bidding. 7. The successful bidder shall have to deposit 25% of the bid amount immediately including the earnest money already deposited. 8. The successful bidder shall be required to deposit the balance 75% of the bid amount within 10 days from the date of confirmation of sale. In case of default in depositing the 25% bid amount immediately or balance 75% of the bid amount within 10 days from the date of confirmation of sale, the secured asset will be forfeited and the secured asset will be resold. 10. All statutory dues/attendant charges/other dues including registration charges, stamp duty, taxes etc. shall be borne by the purchaser. 11. This publication is also 15 days' notice to the above mentioned borrowers/guarantors/mortgagors being the subsequent sale. For further details and complete Terms & Conditions, please visit the following websites and/or contact the Nodal Officers/Authorized Officers mentioned above against each property: www.pnbidia.biz; www.pnbindia.in; www.eprocure.gov.in

DATE: 01.05.2019
PLACE: NEW DELHI
AUTHORIZED OFFICER, PUNJAB NATIONAL BANK

